

વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ: 8, સત્ર: 1
પ્રકરણ - 2 પુષ્પ અને ફળ

1.વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે ?

- (A) પર્ણ
- (B) પ્રકાંડ
- (C) પુષ્પ
- (D) મૂળ

2.કોને ફૂલમણિ પણ કહે છે ?

- (A) પુષ્પાસન
- (B) દલચક્ર
- (C) પુષ્પદંડ
- (D) વજ્રચક્ર

3.નીચેના પૈકી પ્રાવર પ્રકારનું ફળ કયું છે ?

- (A) ચોળા
- (B) મકાઈ
- (C) ભીંડા
- (D) વટાણા

4.પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજ પરાગનલિકા દ્વારા કોની સાથે જોડાય છે ?

- (A) બીજાંડમાં અંડકોષ સાથે
- (B) પરાગતંતુ સાથે
- (C) પરાગવાહિની સાથે
- (D) પરાગાશય સાથે

5.નીચેના પૈકી શુષ્ક ફળ કયું છે ?

- (A) કેરી
- (B) જાંબુ
- (C) કપાસ
- (D) નાળિયેર

6.પુષ્પ જેના ઉપર ગોઠવાયેલું હોય છે, તે રચનાને શું કહે છે ?

- (A) પરાગાસન
- (B) પુષ્પાસન
- (C) પુંકેસરચક્ર
- (D) સ્ત્રીકેસરચક્ર

7.બીજાશયમાં નાના દાણા જેવા ભાગને શું કહે છે ?

- (A) પરાગરજ
- (B) પરાગાશય
- (C) બીજાંડ
- (D) પરાગતંતુ

8.નીચેના પૈકી કોનો સમાવેશ પરાગરજના વાહકોમાં થતો નથી ?

- (A) ભમરો
- (B) પતંગિયું
- (C) માખી
- (D) મધમાખી

9. પુષ્પનો કયો ભાગ કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે ?

- (A) દલચક્ર
- (B) પુષ્પાસન
- (C) પુંકેસરચક્ર
- (D) પરાગાશય

10. નીચેના પૈકી માંસલ ફળ કયું છે ?

- (A) વાલ
- (B) ટામેટાં
- (C) ભીંડા
- (D) વટાણા

11. પુષ્પના નીચેના ભાગે આવેલા પહોળા ભાગને શું કહે છે ?

- (A) પુષ્પાસન
- (B) પરાગાસન
- (C) પરાગાશય
- (D) દલચક્ર

12. સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે ?

- (A) પરાગાસન
- (B) બીજાશય
- (C) બીજાંડ
- (D) પરાગવાહિની

13.નીચેના પૈકી ધાન્ય ફળ કયું છે ?

- (A) કપાસ
- (B) ચોળા
- (C) મકાઈ
- (D) ભીંડા

14.નીચેના પૈકી શિમ્બ(શિંગ) પ્રકારનું ફળ કયું છે ?

- (A) ભીંડા
- (B) કપાસ
- (C) ચોળા
- (D) ઘઉં

15.પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે ?

- (A) વજ્રપત્ર
- (B) પરાગાસન
- (C) પુષ્પદંડ
- (D) દલપત્ર

16.પરાગરજ શામાં ઉત્પન્ન થાય છે ?

- (A) પરાગનલિકા
- (B) પરાગાસન
- (C) પરાગવાહિની
- (D) પરાગાશય

17.પરાગાસન કોનો ભાગ છે ?

- (A) પુંકેસરનો
- (B) પરાગનલિકાનો
- (C) પરાગાશયનો
- (D) સ્ત્રીકેસરનો

18.સ્ત્રીકેસરના સૌથી ઉપરના ભાગે આવેલા ગાદી જેવા ભાગને શું કહે છે ?

- (A) પુષ્પાસન
- (B) બીજાશય
- (C) પરાગવાહિની
- (D) પરાગાસન

19.પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ?

- (A) વજ્રચક્ર
- (B) સ્ત્રીકેસરચક્ર
- (C) દલચક્ર
- (D) પુંકેસરચક્ર

20.પુષ્પના બધા ભાગો કોની સાથે જોડાયેલા છે ?

- (A) પુષ્પાસન
- (B) પરાગાસન
- (C) પુષ્પદંડ
- (D) દલચક્ર

વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ: 8, સત્ર: 1

પ્રકરણ - 2 પુષ્પ અને ફળ

જવાબો - પ્રશ્નપત્ર :

કુલ પ્રશ્નો: 20 / કુલ ગુણ: 20

(1) C

(2) B

(3) C

(4) A

(5) C

(6) B

(7) C

(8) C

(9) A

(10) B

(11) A

(12) B

(13) C

(14) C

(15) A

(16) D

(17) D

(18) D

(19) A

(20) A